CORPORATE OFFICE: 2nd Floor, A Wing, Fortune Avirahi, Jambli Galli Jain Derasar Lane, Borivali (W), Mumbai - 400 092.

🕥 +91-22-5070 5050 / 2898 2133 / 7912 / 7914

compliance@heranba.com

www.heranba.co.in

CIN No.L24231GJ1992PLC017315



Date: January 30, 2023

BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400001, Scrip Code: 543266 National Stock Exchange of India Limited Exchange Plaza, 5th Floor Plot no. C/I, G Block, Bandra - Kurla Complex, Bandra(E), Mumbai - 400 051. Symbol: HERANBA

Sub: Newspaper Publication of Financial Statements/Results for Quarter ended December 31, 2022

We refer to our Letter dated January 28, 2023 wherein we informed the outcome of the board meeting held on **Saturday, January 28, 2023** inter alia, to consider and approve the unaudited Finacial results for the Quarter and Half year ended December 31, 2022.

Further we wish to inform that the financial statement for the quarter ended December 31, 2022 approved at the meeting of the board of directors have been published in the following newspaper(s):

- 1. Financial Express (Ahmedabad) dated January 29, 2023
- 2. Financial Express (Ahmedabad in Gujarati) dated January 29, 2023

The extract(s) of the aforesaid Newspaper Publication are enclosed herewith.

You are requested to kindly take the above information on record.

Thanking you, Yours Faithfully, Heranba Industries Limited

Abdul Latif Company Secretary and Compliance Officer Membership No.: A17009 Date: January 30, 2023 Place: Mumbai

Enclosed as above.





ECONOMY

Govt forms 3 appellate tribunals to look into user grievance against social media

FE BUREAU

New Delhi, January 28

THE GOVERNMENT HAS formed three grievance appellate committees (GACs) with three members each to look into the complaints of users of social media firms like Twitter, Facebook and other such platforms. The online platform where the users can file their grievances will be operational from March 1, keeping in view the transition period and other technical requirements of the intermediaries, the ministry of electronics and information technology (MeitY) said.

The notification comes three months after the government tweaked the IT rules for setting up such GACs. These committees will address complaints by users relating to blocking of content or accounts by the grievance redressal officers of the social media firms concerned, within a period of thirty days of receiving them.

"The need for GAC was created due to large number of grievances being left unaddressed or unsatisfactorily addressed by internet intermediaries. GAC is expected to create a culture of responsiveness amongst all internet platforms and intermediaries towards their consumers," MeitY said in a release.

As per the framework, each of the three GACs will have a chairperson, two whole-time members from different government entities and retired senior executives from the industry for a term of three years from the date of assumption of office.

The first panel will be chaired by the chief executive officer of the Indian Cyber Crime Coordination Centre under the ministry of home affairs. The whole-time members in the panel include Ashutosh Shukla, a retired Indian Police Service officer and



Sunil Soni, former chief general manager and chief information officer of Punjab National Bank.

The second panel will be chaired by the joint secretary in charge of the Policy and Administration Division in the ministry of information and broadcasting. It will include Sunil Kumar Gupta, retired former director of Personnel services at Indian Navy and Kavindra Sharma, former vice-president of consulting at L&T Infotech.

The third panel will be chaired by Kavita Bhatia, a senior scientist at the ministry of electronics and information technology. Sanjay Goel, former traffic service officer of the Indian Railways, and Krishnagiri Ragothamarao, former managing director and chief executive officer of IDBI Intech, have been appointed as the whole-time members of the panel.

The government had first talked about constituting GACs in June last year but had said that if the industry came up with a self-regulating mechanism, then it was willing to consider that instead. However, the industry's initiative for a self-regulat-

ing mechanism failed due to lack of unanimity amongst all the players.

Some of the concerns raised by the experts on the GACs structure include the presence of government officials in the GAC working group, possibility of censoring of speech and freedom of speech threat, compliance over-burden on intermediaries, and absence of rules regarding proceedings of GACs.

As per the new IT rules, a social media company will have to remove any misinformation and illegal content which is obscene, pornographic, invades another's privacy, insulting or harassing on the basis of gender, racially or ethnically objectionable, relating or encouraging money laundering or gambling, among others, within 72 hours of receiving the complaint. Last year, the minister of information technology and electronics Rajeev Chandrasekhar also warned the companies of losing access to their safe harbor status on not complying with the IT rules. Currently, under Section 79 of ITAct 2000, intermediaries are protected from any legal prosecution related to

content on their platforms. If they lose the safe harbor status, they will lose that legal immunity for the content posted on their platforms.

BMW to launch 16 cars and two bikes in 2023

VIKRAM CHAUDHARY New Delhi, January 28

BMWINDIA, WHICH in 2022 posted the highest-ever car sales in its history – with 11,981 cars sold (11,268 BMW brand and 713 MINI) — is confident that 2023 will be another record year.

Vikram Pawah, president, BMW Group India, told FE that the brand will launch 16 cars and two motorcycles in 2023, adding that there is increasing customer interest in its five electrified models, and all its existing cars continue to be in high demand.

Sc. Quarter Ended Year Ended Year Ended 1 folal Revenue 1,3,2022 31,2022 31,2022 31,2022 2 Profit lefore exceptional liems and tax (19,004) (4,113) (87,949) 3 Net Profit for the year before tax (after exceptional items) (29,154) (9,722) (96,400) 3 Net Profit for the year after tax (after exceptional items) (29,154) (57,72) (55,19) (91,304) 4 Net Profit for the year after tax (after exceptional items) (29,154) (6,722) (96,400) Vorting facility to empany has appoint or the gar after tax (after exceptional items) (29,157) (0,306)* (2,984) 6 Paid.up Equity Share Capital (Par value of Rs. 10 each) (0,857)* (0,307)* (2,984) In accordinate with Taxing and tax many 30,2023 (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* In accordinate with Taxing and tax many 30,2023 (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,800)* (1,80	8	RELIANCE POWER POWER Extract of the Consolidated Financial Results for the	Ground Floor, 19 Tel: 91 22 43031 Email: reliancep	000 Fax : 91 22 ower.investors@ Ied Decemb	2 43033166 Prelianceada.com er 31, 2022	certain identified P
No. December December March- 31, 2022 March- 31, 2022 March- 31, 2022 1 Total Revenue 1, 35, 893 7, 68, 673 2 Profit for the year before tax (after exceptional items) (19,004) (1,113) (67,949) 3 Net Profit for the year after tax (after exceptional items) (19,004) (1,113) (67,949) 4 Net Profit for the year after tax (after exceptional items) (19,004) (1,113) (67,949) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,866 3,40,013 3,40,013 7 Earnings Per Share (Face value of Rs. 10 each) (0,857)* (0,306)* (2,984) (b) Diluted (Rs.) (0,857)* (0,307)* (2,984) In accordance with 11 1 Total Comprehensive income (1,85) (0,417)* (2,704) In accordance with 11 1 Total Revenue 3,300 375 (7,202) (7,204) 8 Extract of the Standatone Financial Results for the uarter Ended December 31, 2022 Total Revenue 1,300 3,300 376 (7,200) (7,210) (7,204)	_		Ouerte			entities as a (opecia
Particulors December (3, 2022) Could (3, 2022) Could (4, 2022) Could (4, 2022) Could (4, 2022) Could (4, 2022) Could (4, 2024) Could (4, 2			•			On Saturday, the Jan
Unauties Restated Restated 1 Total Revenue 1,33,623 1,85,893 7,86,73 3 Net Profit (before exceptional items of 19,004) (4,113) (67,949) 4 Net Profit (bes) for the year after tax (after exceptional items) (29,154) (9,722) (96,400) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,866 3,40,013 3,40,013 7 Earnings Per Share (Face value of Rs. 10 each) (0,357)* (0,307)* (2,984) (b) Diluted (Rs.) (0,0377)* (0,307)* (2,884) (b) Diluted (Rs.) (0,357)* (0,307)* (2,884) (b) Diluted (Rs.) (0,357)* (0,307)* (2,884) (b) Diluted (Rs.) (0,1000) (2,984) In accordance with It Baltot along with Poist 8 Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Members. The base financial Results for the Quarter Ended Network 1 Total Revenue 3,300 3,76 18,202 2 Profit /(Loss) before exceptional items and tax (8,491) (7,220) (27,	NO.	Particulars				with the Login ID and
1 Total Revenue 1,33,529 1,85,893 7,68,673 2 Profit before exceptional items and tax (19,004) (4,113) (87,949) 4 Net Profit Orbe year after tax (after exceptional items) (29,154) (9,722) (96,400) 5 Total Comprehensive Income for the year (24,517) (5,519) (91,364) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,66 3,40,013 3,40,013 7 Earnings Per Share (Face value of Rs. 10 each) (0.857)* (0.306)* (2.984) (hot annualised for quarter ended) (0.857)* (0.307)* (2.984) 8. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 11, 2022 Unautited Total Revenue 3,300 3,976 18,408 2 Profit (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) 1 total Revenue 3,20,263 3,40,013 3,40,013 2 Profit (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,732) 1 total Revenue 3,20,263 3,40,013 3,40,013 2 Profit (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,732) 2 T						id's with Depository P
2 Profit before exceptional items and tax (19,004) (4,113) (87,949) 3 Net Profit (coss) for the year after tax (after exceptional items) (19,004) (4,113) (67,949) 5 Total Comprehensive Income for the year (24,517) (5,519) (91,364) (07,007) (3,64,001) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) (0,857)* (0,306)* (2,984) (0,857)* (0,307)* (2,984) (19,004) (4,113) (87,949) (0,07,07)* (2,984) (0,07,07)* (2,984) (0,07,7)* (2,984) (0,07,7)* (0,307)* (2,984) (0,07,7)* (2,984) (0,07,7)* (0,0307)* (2,984) (0,07,7)* (0,0307)* (2,984) (0,07,7)* (0,0307)* (2,984) (0,07,7)*	-	Total Revenue		4		The Read of Directo
3 Net Profit for the year before tax (after exceptional items) (19,004) (4,113) (87,949) 4 Net Profit (Loss) for the year after tax (after exceptional items) (24,514) (9,722) (96,400) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,866 3,40,013 3,40,013 3,40,013 are requested to not are reques	· ·					
4 Net Profit (Loss) for the year after tax (after exceptional items) (29,154) (9,722) (96,400) 5 Total Comprehensive Income for the year (24,517) (5,519) (91,364) votig facility to empray this appoint voting facility to empray the appoint voting facility to empray and theappoint voting facility to empray the appoint v						100 BB22
5 Total Comprehensive Income for the year (24,517) (5,519) (91,364) 6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,866 3,40,013 3,40,013 a,40,013 7 Earnings Per Share (Face value of Rs. 10 each) (0.857)* (0.307)* (2.984) in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 in accordance with the Standalone Acuited The Autited The Company and the Capital 3, 300 in accordance with the Cauter Acuited The accordance with the Cauter Acuited The Cau		,		· · ·		
6 Paid-up Equity Share Capital (Par value of Rs. 10 each) 3,62,866 3,40,013 3,40,013 3,40,013 are requested to not are images of the comparison			• • •			
7 Earnings Per Share (Face value of Rs. 10 each) (for continuing and discontinuing operation) (a) Baic (Rs.) (b) Closen (Continuing and discontinuing operation) (a) Baic (Rs.) (b) Closen (Continuing and discontinuing operation) (b) Soluted (Rs.) (c) (a) Soft* (c) 284) In accordance with II Bailot along with Pose B. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Total Revenue Year Ended Year Ended Year Ended 8. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Year Ended Year Ended Year Ended 9. Porticulars December December Manuary 30, 2023 Year Ended 1 Total Revenue 3, 300 3, 3976 13, 400 Year Ended 2 Profit / (Loss) before exceptional items) (6, 491) (7, 220) (27, 040) Members who have methods web bites 3 Profit / (Loss) before tax (after exceptional items) (6, 491) (7, 220) (27, 040) Members who have method become / Loss) Members who have method become / Loss) Whit the Company a dia dia so shall not solution / Loss) Yeas in a solute / Loss / L						
(for continuing and discontinuing operation) (0.857)* (0.306)* (2.984) Januairy 30, 2023 (a) Basic (Rs.) (0.857)* (0.307)* (2.984) In accordance with 10 (b) Diluted (Rs.) (0.857)* (0.307)* (2.984) In accordance with 10 (b) Diluted (Rs.) (0.857)* (0.307)* (2.984) In accordance with 10 (b) Diluted (Rs.) (0.857)* (0.307)* (2.984) In accordance with 10 (c) Revenue (0.857)* (0.307)* (2.984) In accordance with 10 St Outerter Ended Year Ended Year Ended Year Ended 1 Total Revenue 3,000 3.976 18,400 C7,040 2 Profit / (Loss) before exceptional items and tax (6,491) (7,220) (27,040) 3 Profit / (Loss) before exceptional items) (6,491) (7,220) (27,040) 4 Profit / (Loss) before exceptional items) (6,491) (7,220) (27,040) 4 Profit / (Loss) before exceptional items) (6,491) (7,220) (27,040) 5 Total Comprehensive incomet/ (Loss) (6,491)			0,02,000	0,10,010	0,10,010	1 Contraction and the second secon
(a) Basic (Rs.) (0.857)* (0.306)* (2.984) (b) Diuted (Rs.) (0.857)* (0.307)* (2.984) (b) Diuted (Rs.) (0.857)* (0.307)* (2.984) B. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Rupees in lakts Balot along with Post to the Members. The place through the end of table. A p notice for information count of the exceptional items and tax (8.491) (7.220) (27.040) 2 Profit /(Loss) before tax (after exceptional items) (8.491) (7.220) (27.732) Profit (Joss) after tax (after exceptional items) (8.491) (7.220) (27.740) 4 Profit /(Loss) before tax (after exceptional items) (8.491) (7.220) (27.732) Picos (1.05, 59.439 5 Total Comprehensive Income/ (Loss) (6.491) (7.220) (27.732) Picos (1.05, 59.439 8 Security Premium Account 11,05,454 11,05,454 11,05,454 11,05,454 11,05,454 10 Dutstanding Debt 61,60.89 (0.250) (0.227) (0.858) Security Premium Account Stars in dematerial interest Service Coverage Ratio 0.21 0.21 0.23 Capital Redemption Reserve Stars in dema	ľ	o (
(b) Diluted (Rs.) (Not annualised for quarter ended) (0.857)* (0.307)* (2.984) B. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 To the Members. The place through the rem Rupees in laking In accordance with the place through the rem Rupees in laking Sr. Quarter Ended Vear Ended Vear Ended December December March 31, 2022 Year Ended Year Ended The voting rights of M the cut-off date. Ap andde for functional the cut-off date. Ap andde for functional terms The voting rights of M the cut-off date. Ap andde for functional terms 1 Total Revenue 3.300 3.976 18,3406 2 Profit / (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,040) 4 Profit / (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,732) 5 Total Comprehensive Income/ (Loss) (6,491) (7,220) (27,732) 6 Predit / (Loss) defore tax (after exceptional items) (8,491) (7,220) (27,732) 7 Reserves (excluding Revaluation Reserve) 5,43,236 (5,91,150 5,59,439 8 Security Premium Account 11,05,454 (10,6459 (0,270) (0,270) 10 Dubt Equity Ratio 0,47 0,47			(0.857)*	(0.306)*	(2.984)	voting module shall b
(Not annualised for quarter ended) Bailot along with Post B. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Bailot along with Post Sr. Rupees in Lakes No Particulars Quarter Ended Vear Ended 1 Total Revenue 3,202 31, 2021 31, 2022 31, 2021 31, 2022 2 Profit / (Loss) before exceptional items and tax (8,491) (7,220) (27,040) 4 Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,040) 4 Profit / (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,732) 5 Total Comprehensive Income/ (Loss) (8,491) (7,220) (27,732) 5 Total Comprehensive Income/ (Loss) (8,491) (7,220) (27,732) 6 Paice (excluding Revaluation Reserve) 5,43,236 5,91,150 5,54,439 9 Net worth 13,19,077 13,25,472 13,18,700 6,16,089 6,17,421 6,17,631 10 Debt Equity Ratio 0.221 0.227 (0.858) Distore Coverage Ratio 0.221 0.27 0.858			. ,	, ,	· /	la accordance with th
B. Extract of the Standalone Financial Results for the Quarter Ended December 31, 2022 Rupees in lakts to the Members. The place through the cem St. No. Quarter Ended December Archive Rupees in lakts St. No. Quarter Ended Team Ended December December March March 31, 2022 The voting rights of M the det-off date. A) and the det-off date. A) second and the second and the second and the second 2 Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,040) Profit / (Loss) before tax (after exceptional items) (8,491) (7,220) (27,732) Please note that the v valid and also shall no mentioned websites d mentioned web			(0.001)	(0.001)	(2.001)	
Rupes in lakts Rupes in lakts St. Rupes in lakts No. Quarter Ended Vera Ended December March Total Revenue 31, 2021 31, 2021 The voting rights of M Total Revenue 3,300 3,376 18,406 Or for // (Loss) before exceptional items and tax (8,491) (7,220) (27,040) Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) Profit / (Loss) before exceptional items) (8,491) (7,220) (27,732) Profit / (Loss) before exceptional items) (3,52,866 3,40,013						

VIRINCHI LIMITED

Regd office: 8-2-672 / 5 & 6, 4* Floor, Ilyas Mohammed Khan Estate, Road No. 1, Banjara Hills, Hyderabad-500 034, Telangana, Tel: 040-4819 9999 Email: investors@virinchi.com Web: www.virinchi.com CIN:L72200TG1990PLC011104

NOTICE OF POSTAL BALLOT

Notice is hereby given pursuant to Section 108, Section 110 and all other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and 22 of th Companies (Management and Administration) Rules, 2014, read with General Circular No 14/2020 dated April 8, 2020, the General Circular No. 17/2020 dated April 13, 2020, th General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dater September 28, 2020, the General Circular No. 39/2020 dated December 31, 2020, the General Circular No. 10/2021 dated June 23, 2021, the General Circular No. 20/2021 dated December 8, 2021, the General Circular No. 03/2022 dated May 5, 2022 and the General Circular No. 11/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars"), read with Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretaria Standards on General Meetings (SS-2) including any statutory modification or re-enactment thereof for the time being in force and pursuant to other applicable laws and regulations, that the Resolution is proposed to be passed by the Members of the Company through Postal Ballot by remote e-voting process ("E-Voting") for seeking approval of Members of the Company for Issue of 2,00,00,000 Convertible Equity Warrants on Preferential basis to certain identified Promoter/Promoter Group and Non-Promoter/Public persons and entities as a (Special Resolution).

On Saturday, the January 28, 2023, the Company has sent the Notice of Postal Ballot along with the Login ID and password to the Members for e-voting who have registered their e-mail id's with Depository Participant(s) or with the Company.

The Board of Directors of the Company has appointed Mr. Vinay Babu Gade, Company Secretary in Practice as the Scrutinizer for conducting the Postal Ballot process.

Members are requested to provide their assent or dissent through e-voting only. The Company has appointed Central Depository Services (India) Limited (CDSL) for providing evoting facility to enable the Members to cast their votes electronically. The detailed procedure for e-voting is provided in the Note No. 12 of the Notice of Postal Ballot. Members are requested to note that the e-voting shall commence from 9:00 a.m. (IST) on Monday, January 30, 2023 and end on 5:00 p.m. (IST) on Tuesday, February 28, 2023. The e voting module shall be disabled by CDSL for voting thereafter.

In accordance with the above mentioned Circulars, physical copies of the Notice of Postal Ballot along with Postal Ballot Forms and Pre-paid Business Reply Envelope will not be sent to the Members. The communication of the assent or dissent of the Members would take place through the remote e-voting system only.

The voting rights of Members shall be reckoned as on Friday, January 20, 2023, which is the cut-off date. A person who becomes a Member after the Cut-off date shall treat this notice for information purpose only. The copy of the Postal Ballot Notice is available on the Company's website at www.virinchi.com. website of the Stock Exchange i.e., BSE Limited at www.bseindia.com and on the website of CDSL at https://www.evotingindia.com Members who have not received the Postal Ballot Notice may download it from the above mentioned websites or write to the Company at investors@virinchi.com.

Please note that the voting beyond 5:00 PM (IST) on Tuesday, February 28, 2023 will not be valid and also shall not be allowed beyond the said date.

Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company are requested to update their email addresses by writing to the Company or RTA at investors@virinchi.com, info@aarthiconsultants.com along with the copy of the signed request letter mentioning the name and address of the Member, self-attested copy of the PAN card and self-attested copy of any document i.e., Driving License or Election Card or Passport or Aadhar Card in support of the address of the Member. Members holding shares in dematerialised mode are requested to register / update their email addresses with the Depository Participants with whom they are maintaining Demat Accounts. In case of any queries / difficulties in registering the e-mail address, Members may write to investors@virinchi.com.

NTPC profit rises by 5% to ₹4,854 crore

RAJAT MISHRA

New Delhi, January 28

STATE-OWNED POWER giant, NTPC on Saturday reported a 5% rise in its consolidated net profit to ₹4,854.36 crore for the December quarter, owing to higher revenue.

The company's consolidated net profit was ₹4,626.11 crore in the same quarter last year.

The total income rose to ₹44,989.21 crore in Q3FY23 from ₹33,783.62 crore in the yearago period.

NTPC's operating profit, calculated as earnings before interest, taxes, depreciation and amortization (Ebitda), rose 36% year-on-year to ₹13,239 crore, but the operating margin dipped to 31.97%.

CENTRAL RAILWAY Material Management Department E-Procurement ADVT.TENDER NoticeNo. E-04/2023, Dt.25-01-2023 Tender No Item Description Quantity **Due Date** 27231022 Terminal for T.M. 955 Nos 14-02-23 27231820 15-02-23 Secondary Spring 103 Nos. 43231417 Belt tensioning device assly. 20-02-23 503 Nos 20-02-23 51230030 Metal liner 75160 Nos 22-02-23 42225015B Set of Items for KBIL make 01 Set Compressor 42231380 POH Kit. 2724 Set 22-02-23 27231456 27-02-23 Set of Step Size Thrower 13 Set 27231752 Set of Brake Gear Pins & Trunion 27-02-23 34 Set 27231043 Oil Cooler Radiator Assembly 12 Nos 28-02-23 27231504 28-02-23 High Capacity After Cooler 53 Nos 27233251 28-02-23 Cylindrical Roller Axle Box Bearing 59 Nos 51230009 373668 Nos 01-03-23 Metal liner (60 kg) 42233694 23 set 16-03-23 Intermediate overhauling kit Detail notice & Tender Conditions can be seen and downloaded from the website www.ireps.gov.in Principal Chief Material Manager/CSM Rail Madad Helpline: 139 844

The resolution if approved shall be deemed to have been passed on the last date of e-voting i.e., Tuesday, February 28, 2023. The result of Postal ballot e-voting will be announced on or before Thursday, March 02, 2023 and will be displayed on the Company's Website www.virinchi.com and communicated to BSE Limited. The Company will also display the results of Postal Ballot at its Registered Office

Mr. K. Ravindranath Tagore, Company Secretary, Virinchi Limited, Regd. Off: 8-2-672/586, 4th Floor, Ilyas Mohammed Khan Estate, Road No.1, Banjara Hills, Hyderabad, Telangana State, India, email: investors@virinchi.com, Ph. No. 040-48199999, is responsible to address the grievances connected with the E-voting and Postal Ballot.

> for Virinchi Limited Sd/-K Ravindranath Tagore Company Secretary M.No. A18894



DCB Bank net up 51% on strong loan growth **AJAY RAMANAT** Mumbai, Janua

DCB BANK'S NE rose 51% year-o in the Decembe ter due to strong in its loans and back of provision

The bank's b line came at ₹11 in October-Decer 2% on a sequenti The bank's ad rose 21% year-o to ₹32,966 cror December 31. Net interest

rose 29.3% ye year to ₹446 ci the quarter review, led b growth in adv Deposits rose vear-on-year ₹39,056 crore December 31.

ZEN TECHNOLOGIES LIMITED B -42 Industrial Estate, Sanathnagar, Hyderabad - 500 018, Telangana, India CIN:L72200TG1993PLC015939

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE NINE MONTHS ENDED & QUARTER ENDED 31ST DECEMBER 2022

		,		£	()	Rs. in lakhs)								
		Standalone		C	Consolidated									
Particulars	Quarter ended 31 Dec, 2022	Nine months ended 31 Dec, 2022	Quarter ended 31 Dec, 2021	Quarter ended 31 Dec, 2021	Nine months ended 31 Dec, 2022	Quarter ended 31 Dec, 2021								
ī	Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited	Un-Audited								
Total Revenue from Operations	3293.29	8729.16	1235.70	5,248.73	12,296.74	1,625.75								
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	869.95	2,714.38	64.35	1,501.19	3,670.56	29.93								
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,069.95	2,914.38	64.35	1,701.19	3,870.56	29.93								
Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	758.25	2,036.68	11.83	1,193.58	2,659.49	(22.48)								
Total Comprehensive Income for the period [Comprising Profit after tax and Other Comprehensive Income (after tax)]	758.73	2,012.25	11.83	1,199.42	2,682.72	(22.33)								
Paid up Equity Share Capital (Re.1/- Per Equity Share)	795.10	795.10	795.10	795.10	795.10	795.10								
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year ended)	30,307.49	30,307.49	28,232.37	29,225.32	29,225.32	27,167.33								
Earnings Per Share (of Re.1/- each) (Not Annualised): a) Basic (In Rs.)	0.95	2.56	0.01	1.19	2.84	(0.02)								
b) Diluted (In Rs.)	0.92	2.50	0.01	1.14	2.76	(0.02)								
(Listing and Other Disclosure Requirements) F	Note : The above is an extract of the detailed format of Quarterly Financial Results field with the Stock Exchange under Regulations 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on company's website at www.zentechnologies.com and the stock exchange's websites, www.nseindia.com and www.bseindia.com. For and on behalf of the Board Sd/- Place : Hyderabad													



Pandemic and after: State of Education



In conversation with

Dr. Rukmini Banerji Chief Executive Officer Pratham Education Foundation



Uma Vishnu **Deputy Editor** The Indian Express

When schools reopened in 2022 after two years of a pandemic-induced shutdown, the biggest fear was about its impact on learning levels of children. Would the hard-fought gains made in learning outcomes over the last few years be lost? Given the large-scale migration and job losses in the wake of the pandemic and the subsequent lockdown, had children dropped out of schools?



CIN: L24231GJ1992PLC017315

An ISO 9001:2015 Company

HERANBA INDUSTRIES LIMITED

Registered Office: Plot No. 1504/1505/1506/1 GIDC, Phase-III Vapi Valsad-396195, Gujarat, India, Corporate Office: 2nd Floor, A Wing, Fortune Avirahi, Jain Derasar Road, Borivali (West), Mumbai-400092, Maharashtra, India

Email: compliance@heranba.com Website: www.heranba.co.in ANT OF UNALIDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL DESULTS FOR THE OLIAPTED AND NINE MONTHS ENDED DECEMPED 21

	STATEMENT OF UNAUDITED STANDALONE AND CONSOLID	ATED FIN	ANCIAL F	RESULTS F	OR THE Q	UARTER A	ND NINE N			
-	0							(₹ in r	millions exc	cept per share data)
~			Stan	dalone	\				Cons	olidated
Sr	Particulars		Quarter En			nths Ended			er Ended	Nine Months Endec
No.			30.09.2022			31.12.2021		31.12.2022		31.12.2022
		· ·		(Unaudited)	1	(Unaudited)		(Unaudited)	(Unaudited)	(Unaudited)
1.	Total Income from operations	2,802.14	4,233.31	3,953.94	10,654.79	11,002.35	14,503.73	2,760.30	4,206.78	10,586.42
	Net Profit/(loss) for the Period (before tax, exceptional items)	183.80	633.42	712.68	1259.86	1,969.86	2,552.50	163.56	626.14	1,229.64
	Exceptional items (expenses)	-		2 - 3	- 5	-	(-)	-	- I	-
	Net profit/(loss)for the period before tax (after exceptional items)	183.80	633.42	712.68	1259.86	1,969.86	2,552.50	163.56	626.14	1,229.64
	Net profit/(loss) for the period after tax (after exceptional items)	143.90	476.81	534.85	957.79	1,464.87	1,890.63	126.36	471.54	932.27
6.	Total comprehensive income/(loss) for the period	145.11	483.37	546.91	962.28	1,474.04	1,891.25	127.58	478.10	936.76
7.	Equity share capital (face value Rs. 10/- each)	400.13	400.13	400.13	400.13	400.13	400.13	400.13	400.13	400.13
8.	Other Equity	-	-	3 - 3	- 3	-	6744.45	-	(i -);	-
9.	Earnings per share- (face value Rs. 10/- each)	-								
	Basic (in Rs.)	3.60	11.92	13.37	23.94	36.61	47.25	3.16	11.78	23.30
	Diluted (in Rs.)	3.60	11.92	13.37	23.94	36.61	47.25	3.16	11.78	23.30
AL										-

Note:

1. The above is an extract of the detailed format of financial results filed with the stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The Full format of these results is available on the stock exchanges website i.e. www.bseindia.com & www.nseindia.com and also on the companies' website www.heranba.co.in.

2. The above results have been reviewed by the Audit Committee and thereafter approved by the board of directors in their respective meetings held on January 28, 2023.

3. The previous financial period figures have been regrouped/rearranged/restated wherever considered necessary.

Place : Mumbai Date: January 28, 2023

financialexp.epapr.in



The latest Annual Survey of Education Report, conducted by the NGO Pratham, offers some answers. While children returned to school in huge numbers in 2022, belying fears that the economic crisis and displacement brought about by the pandemic would lead to dropouts, the grim news was that, as expected, the disruption led to a big drop in learning levels in most states, across both government and private schools and for both girls and boys.

To explain what that means for the future of education and our children, listen to Dr. Rukmini Banerji, CEO of Pratham Education Foundation, in conversation with The Indian Express's Uma Vishnu at the next Explained.Live event.







By Order of the Board

Raghuram K. Shetty

Managing Director

DIN: 00038703

Sd/

For Heranba Industries Limited

	ઓફીસ : ૧૯–એ, દ્યુલેશ્વર	ગાર્કન, સાવભેર રોક, વયપુર-૩૦૨૦૦૧ (CIN : L36911RJ1996PLC				3 2	N : L2423	5 रुद्धी ज 16.11992	LC01731	8.5 5				
	પરિશિષ્ટ –૪ (ગુ	ઝો નિચમ ૮ (૧)) કળજા નોટીસ												
જત જણાવવાનું કે, સિક્યોરીટાઇઝેશન અને રીકન	નસ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એ	સેટ અને એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એક્ટ, ૧૦૦૨ (૨૦૦૨ની ૫૪) હેઠળ અન	ને શિક્યોરીટી ઇન્ટ રેસ્ટ		કોપોરેક સોફીસ: બીજો માળ, શે– વિંગ, ફો	સ્ટ્રીન અલિ	ાસલી, જેન	દેશસર શે.	ક, બોરીવર્લ	∣− વેસ્ટ, મુંબ	El 80006.5	મહારાષ્ટ્ર, ભ	154	
(સન્ફ્રાસમટ) બિસમાં, ૨૦૦૨ ના બિસમ (૩) સાઉ અહિંદન અદિલ ગેરકે તીવે એપણમાં ભાખતેલ ઉ	લ વગાતા કલમ ૧૩ (૧૨) હઠળ વાર આનો પ્રત્નાપાર ભાખોળ નો દીસ પ	લાની નળીલી સંદાની ફેઝ સંયુ સ્માલ ભૂમાનાન્સ બે ક લોમોટક (જિક્તુલ કોમોસના બેક જયાની નળીલ ી કર દિવસની સંદર ભ્યાપેક નો દિવસ કાર્યોક વ્યક્તિ કરતો જ બ્યાસના પડે ન) ના નાંચ શહા કરના ર છે જ્યારેલ દેવાડો છે છે.	- I	स्मेहसः compli	ance@h	anba.com	n बेजसाह	a : www.h	eranba.co.ir	1			
માંગણાં નોટીશ વારી કરી હતી.	erne bigene fendet fucter f	שמוינו מנויותו לה והאדורה הוהד אבוותו אורוניה אבוותו בסיה אלוואר ווה א	A TORNEL CARGIER		૩૧ કિસેમ્બર, ૨૦૨૨ ના સેજપૂસ થતાં વિમાસિક સ	ને નવ મા	रेक आभा	ના અનઓ	લેટેક અલા	યદા અને સંચ	बुक्त नाएसी			
देशाहाजे/अ.इदेशाहाजे/जीवरोहाव/	a a (a) जो बी अजी		noted allowed								-	(3.	મીલીયનમાં	, શ્વેર દિક કેશ શિવાય)
		ગીરો મિલકતની વિગત		-	મ વિઝનો				arsej				zła	
જામાનદારાના નામ/ લાન નખર				- 4	L					Sister.	orbei alà A. A. Arres	Bader	Ele bana	ALL REAL PROPERTY AND A DECEMBER OF A DECEMB
	ર૯–ઝુલાઈ–૧૭	ફકપ, એરોરામેન્ટ નં. ૮૦૮, મુસમ—મેથાન, તારિધાપુર, જિલો–પાટણ, ગુજરાત–૩૮૪૨૯૦	૨૪–૧૧=થુઆરી–૨૩	- I		(a.c.)			(as califiers)	(and the	(alifia)	(and it is)	(al-Súz-te)	(aradiita)
				1	કામલગ્યાંથી કુલ આવક	9,003.53	8,433.91	3,493.01	10,742.46	19,001.34	41,503.83	1,#ja.3a	¥,tui,Ac	40,405,29
ગીરવેદાર), શ્રીમતી ગીતાબેન ઇગ્રારભાઇ				2		363.64	çuxe	#00.5¢	9845.24	1,646.03	0,000,00	4174	(afta	4,040.13K
રાવલ (શલ–દેવાદાર)		પશ્ચિમ : બાજુની મિલક્તનો દરવાજો અને માઝુંન જમીન, ઉત્તર : મેલામાઇ જી રાવલની		3		-	-							
1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1 1	રક-ગુલાઇ-વક મુજબ	સેમન દિવાલ, દક્ષિણ : મેલાભાઇ જી સવલના ઘરની બાયુની સેમન દિવાલ		4					144.44	1,848.01	6,898,39	443446	NUAR .	1,000,02
(A/o No.) 1.9001060100590961	૧૧–૨મેપ્રિલ–૧૮	પસોટ નં. ક્લ પૈકી દક્ષિણ બાજુએ, શિટ નં. ૪૫, સિટી સર્વે નં. ૩૫ક પૈકી, મ્યૂ. નં. દુ/વસ્વ૦,	ax-m-mail20120-az	5					CUR	100.0	4,404-03	11(.3)	MARK .	616.M
	3. 8,30,304/-	તાલુકો–ડિસા, બિલો–બનાસક્રાંકા, ગુજરાત ખાતેની રેસીકેન્સીયલ/કોમંસિયલ મિલકત	a manue	5					CQ2.4C N22A3	5,884.09 202,53	9,005.79	Sal.4c	Mc.Ro NECAR	C1646
	(રૂપિયા છલાખ ત્રીસ કેવ્લર	ભગીન/બિલ્કીંગ/ટટક્સર અને કિક્સર્ટના તમામ ભાગ અને કિસ્સા. ક્ષેત્રકળ ૮૩.૬૪		- É							MARIAN			
- a - a	સારશો સુધ્મોતેર પુરા)	શો.મી. અને બાંધકામ સેરિયા પદ શો.મી પર્વ : ૨૦ કટનો પ્રકોળો રોડ. પશ્ચિમ : રકીમ		9			-			_	-			
દવાદાર અને ગોરવેદાર)	૧૦-સંદિલ-૧૮ મુજબ				મળ (ગ્ર.માં)	340	49.64	43.84	83.69	16.44	M.N.	3.46	****	43.30
(A/: No.1 0001080117033751	૧૮–ઓક્ટોબર–૨૨			- L	ઘટાકેલી (ગ્ર.માં)	34	41.24	0.8	6768	34.64	28.01	2.45	N.M	41.30
	3. 99.00.900/-		40-stadentei-62	न	થિ: ૧. રોબી (દિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને કિસ્કલોપ્રર રીકવાચરમેન્ટ્સ)	નિયમનો	, 2094 01	નિશમન ૩	ම ම ම ග ක ක ක	ક એક્સરો બ	ભાં ફાઇલ ક	રેલ વિગતવ	Alisum- Su	ા પરિણામોનો સાર ઉપર
	(રૂપિયા બાવીસ લાખ એંસી			3	જાય છે. આ પરિષ્ટામોની સંપૂર્ણ માહિતી સ્ટોક એક્સરેન્જોની વેબસાઇટ એ	ww & fas	v.bseindia	.com સાને	www.nsei	wia.com a	ને કંપનીની	dousines a	ww.heranb	a.co.in પર ઉપલબ્ધ છે.
	હબાર બરશો સાત પુરા)		1 1	- a.	. ઉપરોક્ત પરિણામોની ઓડિક કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અ	ને ત્યાર૦	1E 36 Me	યુઆરી, સ	भेते १७ १९४	ચોજારોલ ભં	iş njê as	fl-lssafe	ioifun ola	લેમાં તેમના દ્વારા મંજૂરી
	વક-ઓક્ટોબર-૨૨ મુવબ	 Charles et al. (1) and the second of the seco												
All contest and a second second	÷	and a second sec		8.	. પાછલા નાણક્રિય ગાળાના આંકકાઓ બરૂર બણાઇ ત્યાં પન:વર્ગીફત/પૂર્ન	allad/y=	ારથાપિત ક	રવામાં આ	વેલ છે.					
દેવાદારો રકમની ચુકવારી કરવામાં બિષ્ફળ ગ	યા છે, પરિણામે દેવાદારો અને જાહે	કેટ જનતાને અહીં નોટીસ આપવામાં આવે છે કે નીંઘે સહી કરનારે ઉપરોક્ત કોલ્ટકમાં જ	ણાવેલ તારીખોનાં સેજ											બોર્ડના હરમથી
જણાવેલ નિયમ ૮ ના જણાવેલ (સચદા) ની કલ	સમ ૧૩(૪) સાથે વાંચન હેઠળ તે/તે	સીને મળેલી સત્તાની રૂએ ઉપરોક્ત કોષ્ટકમાં જણાવેલ મિલકતનો કળજો લઇ લીધો છે.		- I									Č Ž(4) B	-કરફીલ લીમીટેક માટે,
				- I										-\@rs
ખાસ કરીને દેવાદારો અને જાહેર જનતાને અહી	ેં મિલકત સાથે કોઇ સોદો ન કરવા	સાવધ કરવામાં આવે છે અને મિલકત સાક્ષેનાં કોઇપણ સોદા એયુ રવોલ કાયનાન્સ બે	ie લીમીટેક (વિડ્યુલ્ક	- I										ਟਪ੍ਰਕਮ ਲੇ. ਬੇਡੀ
કોમર્સિયલ બેંક) નાં ઉપરનાં કોષ્ટકમાં જણાવેલ	રકમ અને તેના પરના વ્યાજના ગ્રા	બંગે આદિાન રહેશે.	-\Bus	21	nu : sjour									મેનેઝુંગ કાયરેક્ટર
देवि के		ાચનાન્સ બેંસ લીમીટેક	et	ારીમ : ૨૮ જાન્યુઆરી, ૨૦૨૩								\$	50655000 : MGUIN	

		ઝ	यु र	મ	ÌG	14	۶I	યવ	414	5. 421y2-302009,	ાંક	đ	ોમી	25	5 (6	શેક્ચુ	<u>ട</u> േ ଚା	મર્સિચલ	બેંક)	
ઈ–હરાજી વેચાણ નોટીર ફાચનાન્સ બેંક લીમીટેટ	લ. આથી ખાસ 5 (શીક્ગુલ્ક કો	કરીને દેવ મર્સીચલ	પરિશિષ ૨૦૦૨ ના નિચમ ૮ ઘાદાર(રો)/સહ-દે બેંક) જેઅહી પછી	ટે—૪—; (૬) ની જો વાદાર(રો) એયુએસર્ચ	છો (જુ ગવાઇઓ /ગીસ્વેદાસ તેફબી તરી	ઓ િ સાથે વંચા :(રો) અન્ કેદર્શાવન	ા ટા સક્યે તા સિક્યે તે જામીનદ વામા આવ	દ (ξ) ની વ દીટાઇઝેશન અ દાર(રો) અને જ શેના અધિકૃત સ	જોગવા ાને રીકન્સ્ટ્ર ાહેર જ્વતાને અદિાકારીએ	,, જચપુર-30૨૦૦૧, ઇરાને એફ ફાચનાલ્સિચ તે નોટીસ આપવામાં આવે લઇ લીધો છે. સિક્સોર્ડ એર ને જાણ કરવામા આવે છે :	મેલકત લ એસેટ્સ અને છે કે નીચે દર્શા લેટ " જ્યાં છે ",	ા વેર ો એન્ફોર વેલ મિલ "જેછે":	ાણ માટેની ^{[મેન્ટ ઓફ સિક્ટ કતો સિક્યોર્ડ લેશ અને ''લેમ છે''ના}	નોટી: દારને મોર્ગ દારને મોર્ગ	સ રેસ્ટ એક્ટ ૧૬ કરાઇ એસએફવ	,૨૦૦૨ હે હતી, જેન ગી એટલે	કળ સ્થાવ ો પ્રત્યક્ષ , કે સિક્યોર્ડ	પરોક્ષ કબજો લેશદારની ની	એયુ સ્મોલ્ રો કોષ્ટકમ	
દેવાદાર/સત-દેવાદાર/	ગોટીસ ૧૩(૨)ની		Pascel	Reedel	મિલક્રતની સર્વેટ્સ મળી		ી દ્વારા બ બીક જા કરવાની તાલીખ		Bussauk	Caucie/26-Caucie/	નોટીસ પા(૨)ની	actively a	Read	Accedent	निसक्तनी सन्दर्भक अस्थियी	क्षेत्रखुनी वारीम खने	બીઠ જયા કરવાની તારીમ અને રાગ્ય	રેન્કર સુપરતગી, ટેન્કર ઝુલવાની અને કરાજીનું	awazud	
શ્વભીનશાશ/વીશ્વેશાશનાં નામ LaanAchoa : LaanAchoa : LaanAchoa : LaanAchoa : LaanAchoa : ત્રમારેશાશ્વાર માનસુખભાશ શાસ્ત્રે ગાસ્ત્રેગ્રે આસ્ટ્રેપ્સાર સામે સારે ગાસ્ત્રેગ્રે આસ્ટ્રિયા પ્રાપ્ત આદાયેશાભાશના પ્રાપ્તી (સત- દેવાદાસ)	તારીમ સાને રસ્મ 30-ગુલાઇ-૧૮ ૨. ૨,૯૭,૩૧૯/- (રૂપિયા બે લાખ સારાણું હભાર પ્રારાણે હભાર પ્રારાણે કભાર પુરા) 30-ગુલાઇ-૧૮ મુજબ	तासील २१गे-२२	વિચત ઋા નં. ૨૦૩, બીજો માલ, "જોન.સી. ભવન", મુક્તમસોની ભવન્ય, દિલી સર્વે લોડે નં. ૩, પ્રિટી સર્વે લો. ૨૫૦, સંજ્લોટ, ગુજરાત. ફોઝફના ૬.૬૬ ચો.ગી.	શિયર્થ કિંમત રૂ. ૪,૦૦,૦૦૦/– (રૂપિયા સાર લાખ પુરા)	કિપોઝીક રૂ. ૪૦,૦૦૦/– (રૂપિયા સાલીસ હબ્લર પુરા)	ગાને સમગ્ર ગાને સમગ્ર ૨૨ ફેબ્રુ- ૨૩ ૨.૦૦ લી ૪.૦૦ લો ૪.૦૦ કે ૪.૦૦ લો ૪.૨૦ લો ૪.૨૦ ૨૨ ૨૨ ૨૨૨૨ ૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨ ૨૨૨ ૨૨૨ ૨૨ ૨	3:ने उन्हे प्र २०- हे प्रु २इ नो रो भ १००० बी १,००० बी	<u>કે સ્ટાઝનું ર</u> ેશ્વળ <u>કે સુરચ્યેલ</u> કાર્યાં કે	व्यास्त का स्वर्थ व्याज प्रत्याप दिख – 6342002553 हारोहार : austiona@ aubank in 9.6–हेन्द्र–२३	૧૦೫-લદાગેગીરગેદારૂનાં નસ Loan Ack No. : LSOO'106073864 ભગવાતી ગૃતું શોગ (ટેલાદાર), મલિપકુમાર પ્રતાપાજી માળી ગે પ્રતાપાજી ગયાજી માળી ગે રુપાછુના પૂર્વ (શાલ-ટેલાદાર), ભગવાતીએન પ્રતાપાજી માળી (સલ-ટેલાદાર)	લાક્રીમ અને ગ્રહ્મ ૧૯-મે-રર રૂ. ૯,૨૮,૨૦૫/- (રૂપિયા નવ લાખ અઠચાવીસ લગ્ગર બરસો પશ્ચ પુરા) વદ્-મે-રર મુગળ	તાકીખ ૨૪– ઉડેરોમ્બર– ૨૨	વિગ્રત મુસ્તમ-કાઉસ નં. ૧ (ગેરેસ ટગે ક-) સિવ બાગ્ર સેમલેશ રોગ ટરે. સેવલ્યુ શર્વે નં. ર, પૈકી ૨+૨ પૈકી ૮ પૈકી પ્લોટ નં. ૩, મોવે-ગામ- ચોલિર, તાલુકી- ચાલ-પુર,	ડિઝર્સ દિશ્લ ફ. (રૂપિયા નવ લાખ પંચાર્ટ્સ હજાર પુરા)	ક્રિયેઝીટ ફેર. ૧, ૦૦ ,૦૦૦/– (રૂપિયા એક લાખ પુઝ)	સામથ સમથ વર્ષ્ટ ૨.૦૦ થી ૪.૦૦ લી ૪.૨૨ લી ૪.૨૨ સ્વિત્ર કર્મ કર્મ કર્મ કર્મ કર્મ કર્મ કર્મ કર્મ	अने अम्ब अने अम्ब नां रोज 40.00 वी 4.00 वाज्या मुत्ती अथवा अ पहेलां	ગુગ્ર અને કાર કુર ગુગ્ર સ્વ કારાવાન્ટર બેંક લીમીટેક., શામાનું સરનાપું - પ(૧૦, સંસ્કૃત શોદિગ, પુરોફિત ફોટેલ બીજો ગાળ એસ.ડીબી ફાઈનાન્ટર પાસે આવુ હાઈવે, પાલનપુર	ດແລ ທີ່ແລ້ ການເປັນແລ ເອການແລ ເອການແລ ເອການແລ ເອການແລ	
Lan AK: No. L9001080100288241, ટરિસભાઇ સ્થારળાક ભીઇ જે રાસભાઇ સિંદ્રભાઇ ભીધના પુત્ર (દેવાદાર), શ્રીમતી નેનાએન રસિલભાઇ ભોઇના પત્ની (સદ– દેવાદાર), આપતાલા રમાસભાઇ	૦૨-માર્ચ-૧૯ રૂા.૩,૨૫,ક૯૬/- (રૂપિયા ત્રારા લાખ પરસીરા કલ્ભર શાતરહે છત્રું પુરા) ૦૧-માર્ચ-૧૯ મુલ્બ	૦૫- જાન્યુઆરી -૨૩	સિદી સર્વે નં. ૧૧૦૦, મોક્સરા નગર પાલિકા, પિલક્ત નં. ૮૮૦૦, ગુજરાત ક્ષેત્રફળ ૩૧ એ. શાર્ક	રૂ. ૨,૫૨,૦૦૦/– (રૂપિટા બે લાખ ભાવન હભાર પુરા)	રૂ. સ્ક્,૦૦૦/– (રૂપિયા છલ્લીસ હભાર પુરા)	૦૪-ગાર્શ- શ્વ ૨.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી પ ગીનીટનાં અમાર્થદિત	કર-મારો- રક નાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા ચુધી અથવા એ પક્ષેલાં	ગુગામાં - ગુગાગ ન અંગુ સ્પોલ હાગદિક , શાગાનું સરનાત્રું :- શિટી રોન્ટર કોગ્પલેક્ષ, રીશેનજી પેટ્રેલ પંપ સાગે, શાગાળાજી રહેક,	ભાનુ પ્રતાપ ટિલા – ૯૩૫૮૦૦૨૬૬૩ દાગેક્લા : auctiona@ aubank in oq-ગાર્શ–૨૩	Loan A/t No. : LB0010801157728224 સ્પાલશાર ત્ર-પ્રવિતેશ સ્પેશભાઇ જે સ્પેશભાઇલન પ્રવૃ (Cauta?),	૧૨–ઓક્ટોબર– ૨૧ ૨.૧૫,૮૩,૯૨૧/–	રદ્- દિરોમ્લર- સ્ર	વિલાશે-બગારાઝંબ, ગુજરાત ખાતેગી મિલાકત શેત્રફળ ૧ ૩૧.૧૬ સે. શર્ક મુક્લમ-સિટીરાર્વે ર્લ. ૧૬૩૮, ૧૬૩૮, ૧૬૪૦, ૧૬૩૮, ૧૮ સેપ ને. ૪,	३. ३९,६०,०००/- (३पिया	રૂ. 3,૨૦,૦૦૦/- (રૂપિયા ત્રાસ	0४-मार्थ २३ २.०० थी.४.००	0૨-માર્ચ- ૨૩ નાં રોજ	િલ્લો. ળનારાકોઠા ૩૮૫૦૦૧ ગુભરાત સેચુ સ્મોલ ફાચનાન્સ એક લીગીટેક., ગ્રામાનું	ભાનુ પ્રતાપ સિંઘ – ૯૩૫૮૦૦૨૬૬૩	
ભોઇ જે રમાસભાઇ ભોઇના પુત્ર (રાહ-દેવાદાર), શ્રીમતી હુંનગોન સવપ્રતાલાલ ભોઇ જે ગાસપતલાલ રમાસલાલ ભોઇના પત્ની (રાહ- દેવાદાર), શ્રીમતી ધનુગેન રમાસલાલ ભોઇ જે રમાશલાલ (જામીનદાર સાને ગીરવેદાર)						વધારા રાહિત	200	તાલુકો—મેપ્રશા, ભિત્તો—અસ્વલી, ગુભરાત–૩૮૩૩૧૫		દુઅદાબેન સ્વશેષ્ટ્રલ ભાવસાર MONDORO શ્રેશિકલ (શલ- દુવાદાર)	(રૂપિશા પંદર લાખ ત્યાંથી હજાર વવટો એકવીઝ પુરા) ૧૧-ઓક્ટોબટ- ૨૧ સુજબ		ગ્રાઉન્ડ ક્લોર, મિલક્ત ન. ૮/૪૩/૩, ગ્રામ પંચાયત-વિશ્લોડ, ભિરો-અરવાદી, રાભરકાંઠા, ગુજરાત. ક્ષેત્રકૃત ૧૨.૦૮૦ ચો.મી.	એક્સ્સીસ લાખ નેવું હજાર પુરા)	લાખ લોશ હન્મર પુસ)	વાગ્યા સુધી પ મીનીટનાં અમાર્થાદિત વધારા સહિત	૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અથવા એ પહેલાં	સરનામું :- શોપ નં. ૧ શી પ, ગ્રાઉન્ડ ક્લોર, અશોક વાટિકા, રાહકારી જીન રોડ, હિંમતનગર, શાબરકાંબ, ગુજરાત.		
LaarAdo No. 19001080100768299 ક્રીસિક સુપ્રદરંભન દાસ ને નુમુદરંભન દાસના પુત્ર (Cattai અને ગીટવેશ: 2, ક્રીબરી સંબલી આદીસ દાસ ને આદિસ દાસના પ્રદ્ધિત્વાદા ઉઝેવાડિયાને પુત્ર (જામીનદાર)	૧૯-ઉસેમ્બર-૧૯ ૨, ૮,૮૭,૯૩૭/- (રૂપિયા આઠ લાખ રીત્યાંશી ભગ નવસો સાકગીસ પુરા) ૧૮-ઉસેમ્બર-૧૯ મુજબ	શ્દ્ર-માર્ચ- શ્ર	કોમસિંચલ યુબિટ ફ્લેટ નં. ૩, ત્રીજો માળ, શોપ નં. ૪૦૩, સર્વે નં. ૧૩૧૭ સ્રાને ગુક્રપ્ર - વેં. વ. ૧૩૧ સેરી ગુક્રાપ્ર - ટેચા નાસ રેડ. લિશો - ચાનોર, ગુજરાત: શેજનલ દ્.૦૪ સો.વી.	રૂ. ૪,૫૮,૦૦૦/– (રૂપિશા સાર લાખ અક્સવન લભાર પુરા)	રૂ. ૪૬,૦૦૦/– (રૂપિસા છેતાલીટ્સ હેન્સર પુરા)	શ્ર- ફેબ્રુ- શ્ર ૨.૦૦ લી ૪.૦૦ વાગ્યા સુધી પ મીનીટનાં અમાર્થદિત વધારા રાહિત	૨૦- ફેલ્ટુ- ૨૩ નાં રોજ ૧૦,૦૦ શી ૫,૦૦ વાગ્શા સુધી અથવા એ પહેલાં	એસુ રમોસ કૃષ્યનાન્સ બેંક સંચનાવું – બેવ સંચનાવું – બેવ સેમ્પ્લેસ, ત્રીજો માળ, પાછક, રવૂલની પાળવા, ૧૫૦ સૂટ રીંગ રોડ, જીવો સબ્કોટ, ગુજરાત–350004.	ભાનુ પ્રતાપ દિશ – દગપ્ટલ્વરદૃરૂ દગોઇલ : autons@ aubank in ૧ ૯- હેલુ–૨૧	ાડવાત-No. : 1900-1060117147371 કબાલ ગાંચે ગાંચનારી (દાઘારર), નધારાયર ઝાડીલેસ રગેશાવાય જે રગેશાવાલના પુત્ર (દાહ-દાઘારર), ક્રિંગ્લાટના ઝાડીલેસ વાયરસાટ WICHCHOR ઝાડીલેસ વાયરસાટ WICHCHOR ઝાડીલેસ (દાહ- દેવાઘારર), રગેશાવેત ગો-તીધાલ	૧૨-ઓક્ટોબર- ૨૧ ૨. ૩૨,૯૬,૨૮૦/- (રૂપિયા બગ્ર લાપ્ય છશ્રું ૯૧૧૨ બરસો એવી પુરા) ૧૧-ઓક્ટોબર- ૨૧	રદ્- ડિરોમ્બર- સ્ર	મુકામ-પિલક્ત નં. ક/વકદ, રિક્રી નં. ૩૨/૨૪૮૬, મુકામ- ભીલોક્ર, સાભરકાંક્ર, ભિલો-અસ્ટલ્લી, મુજરાત. ક્ષેત્રફ્લ ૧૬૦.૪૪ સી. સાર્ક	રૂ. ૩૮,૦૫,૦૦૦/– (રૂપિયા આડત્રીરા લાખ પશ્ચિ ભગર પુરા)	રૂ. 3,૮૧,૦૦૦/– (રૂપિયા ત્રાપ્ટ દ્યાખ એક્સાંગી હબ્લર પુરા)	૦૫–માર્ચ– સ્ટ્ર ૨.૦૦ સી ૪.૦૦ લાગ્સા સુધી પ ગીનીટનાં અગાર્થાદિત વધારા	કર–માર્ચ રક નાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અથવા એ પહેલાં	સેચુ સ્પોલ ફાચનાન્સ ગેંક લીમીઢેક., શામાનું સસ્નાગું :- થોપ નં. ૧ લી પ, ગ્રાઉન્ડ ફ્લોર, સરાઉન્ડ ટી જીન સેડ, હિંમતનગર,	ભાન્યુ પ્રતાપ સિંદા – લ્૩૫૮૦૦૨૬૬૩ દાગેદાલ : ક્રાડtionક@ aubank.in oq-માર્ચ-૨૩	
LoarAGNO.: 1500(1987)21825720, મૌસાં 2000(1987)21825720, મૌસાં 2000(1987)21825720, મૌસાં 2000(1987)21825720, મોસાં 2000(1987)21825720, મોસાં 500(1987)21825720, મોસાં 500(1987)2182720, મોસાં 500(1987)2182720, મોસાં 500(1987)2182720, મોસાં 500(1987)2182720, મોસi 500(1987)2182720, મોસi 500(1987)2182720, મોસi 500(1987)2182720, મોસi 500(1987)2182720, મોસi 500(1987)2182720,	મુંજ્ય કરતો ગુજરાતુ કરત કરતો ગ્લાક વ્યુપર કરતો ગ્લાક વ્યુપર સાળ છુ જેજર કરતો ગ્લાક સુંજ્ય સુંજ્ય સુંજ્ય સુંજ્ય	૨૯– ઓક્ટોબર –૨૧	મુકામ-શેપ નં. એટ્રેજીર ગ્રાઉન્ડ કરવોટ, સંસ્થમ ટેસિકેન્ટ્રી-એ. રેવન્ચુ સર્વે નં. વ્યદ[40] વપદ(4)એ બ્લોક નં. વર શી દ રાગે વક દ્વી ઘદ, મેથે-ગોલ્વા, પેટા જિયો-પલસાથા, યુટલ, ગુજરાત- 30૪3૨૭	રૂ. ૩,૮૨,૦૦૦/– (રૂપિશ ગર લાખ બ્યાંશી લગાટ પુરા)	રૂ. (રૂપિયા સાલીસ &ગતર પુરા)	२२- देखु- २३ २.०० थी इ.०० वाञ्या सुधी प मीजीटनां अमार्थादित वधारा राहित	૨૦- ફેલ્ટુ ૨૩ નાં રોજ ૧૦.૦૦ શી ૫.૦૦ વાગ્યા સુધી અથવા એ પ હે લાં	એવુ રમોલ ભાષળાન્ટા ગેંક વીમીઠેક., શામાનું રાસ્માર્ગુ - વર્ષ(૧૨, બીજો માળ, જે દ તેન્ટર, ન્યુ ઇન્કમ ટેક્સ ઓફ્સિ સામે, સ્ટાર બઝાર પાસે, અડાપલ, નિધો યુટ્સ-૩૯૫૦૦દ, ગુજરાત.	ભાગ્યુ પ્રતાય સિંઘ – દગ્યુટ૦૦વદ્દરૂર છમેકલ : auctions@ aubank.in auctions@	(214)-ÈCELE (2) LEGAT-REALE (2) LEGAT-REALE (2) LEGAT-REALE (2) 2010 (2010) (2010) 2010 (2010) (2010) (2010) (2010) 2010 (2010) (2010) (2010) (2010) (2010) 2010 (2010) (2	ગંગ્લન ગંગ્લા કંપ્રેલ્લ ગંગ્લાક્સાલુક્સ ગંગ્લાકસાલુક્સ ગંગ્લાકસાલુક્સ ગંગ્લાકસાલુક્સ ગંગ્લાકસાલુક્સ ગંગ્લા ગંગ્લાક ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લન ગંગ્લ ગં ગંગ્લ ગંગ્લ ગંગ્લ ગંગ્લ ગંગ્લ ગંગ્લ ગં ગંગ ગંગ ગંગ ગં ગંગ ગંગ ગંગ ગં ગંગ ગંગ ગંગ ગં ગં	૦૮- બાન્યુઆરી –૨૩	ગુકામ-ફિસેલ્ડ- ગ્યુન્દિશિવલ લીમેરિ ૫ પ પ્રજાપલીની ચાલી, અમદાવાદ, ગુજરાત ખાતેની મિલસ્ત. ફોઝફન ૫૦ ચો. માર્ક	રૂ. ૮,૮૧,૦૦૦/– (રૂપિશા આઠ લાખ એકચાંશી હભાર પુઝ)	રૂ. દ૦,૦૦૦/- (રૂપિશ નેવું હબાર પુરા)	રાદિત અમ-માર્ચ- રા ૨.૦૦ વી ૨.૦૦	9૨-માર્ચ- 23 નાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અક્ષલા એ પહેલાં	રાળસ્કાંક, ગુજરાત. એચુ રખોલ ફાચનાન્સ ગૅક લીમીટેક., શામાનું સરનાયું :- ૩૦૪- ૩૦૭, રીજો માળ, સાર્થિક–ર, રાજ્યા કલાળ સાપે, સેસજી લાઇરો, સ્ટામદાવાદ– ૩૮૦૦૫૪	ศนครู่ นะเนน (2) (ธ. – (342002 6 (ร.) ยาไมย (ะ suctiona (2) aubank in ot – + มส์ – 23	
LBARACNO: LBOOTOGOB 18356059 & 180071099114487087, ખંસીધાર કલ્લોય સ્ટોટ અન્યે વાલાવારી કેલાં ક્લાનાં જે ક્લાનાં દના પુત્ર (દેલાકાર), વાલાવારી કેલાં ક્લાનાં જે કેસાનંદના પુત્ર (દેલા-દેવાર), વાલવારી કેલાં ક્લાનાં જે કેસાનંદના પુત્ર (દેલા-દેવાર), વાલવારી કેલાં ક્લાનાં જે કેસાનંદના પુત્ર (દેલા-દેવાર), વાલવારી કેલાં ક્લાનાં જે	૧૬સાટેમ્બરસ્વ ફ્રે. ક,૮૬, ૧૯૪/- (રૂપિસા સાત લાખ અસાંથી ક્લનર ચારસો ચોરાવું પુરા) અને ફ્રે. ૧૯,૭૮, ૦૫૪/- (રૂપિસા ઑગાશીસ લાખ ઇઠોતેર હજાર શ્રોપ્યન પુરશ) ૧૪સાટેમ્બરસ્વ	સ્ટ- ક્રિસેમ્બર- સ્ટ	મુકામ-ગ્યુબિસિપ્લ કોર્પોરેશન ફ્લેટ નં. ૩, પહેલો માલ, બંદરિકર કોર્પાલેશ, સર્વે નં. ૧૯૩૭/બી, ગિલકત નં પલપ-૧૯૫4, ગ્વેટિક શાશ્રમ સાયે, જિતો- ચુસ્ત ખાતેની બિલક્ત. શેમફળ ૮૦.૨૬ ચો.મી.	રૂ. ૧૫,૦૦,૦૦૦/– (રૂપિસા ર્યદર લાખ પુરા)	રૂ. ૧,૫૦,૦૦૦/ - (રૂપિસા સોસ હન્મર પુરા)	૦૪–ગાર્શ– શ્રેક ૨.૦૦ સી ૪.૦૦ વાગ્સા ગુદ્ધી પ ગુદ્ધી પ ગીનીટનાં આમાર્શદિત વધારા રાહિત	૦૨-માર્ચ નાં રોજ ૧૦.૦૦ રી ૫.૦૦ વાગ્યા ચુલી અથવા એ પહેલાં	ઝેલુ સ્પેલ ફાયનાન્સ ગૅક લીમીટેક., શામાનું સસ્લાવું - વવ/વર, બીરતે માલ, જેદ શેન્સ્ટ, ન્યુ છ ક્લ્મ ટેક્સ ઑફ્સિટ લાયે, સ્ટાટ બઝાટ પાટે, અડાપલ, વિશો સુરત:- ક્લ્પ00દ, ગુજરાત.	ભાનુ પ્રતાપ કિંદા – દ3પccoəફદ્ દ3પcci autions@ aubankin ન્વ–ગાર્થ–રગ	Loan A& No. LSOO (080719527482 કલાદેવ સોવે (દેવાદાર), ભારોવાવ્યા કલાભાઇ પ્લખાતી જે કલાભાઇના પુર (રાત-દેવાદાર), શિયએન ભારોવાભાઇ પ્લાન્સ (WIC)AD ઉદરાવાદ્ય (સ્વત- કેસ્ટોસ), આંગ ટેલેક્સુલા દેવાદા જે સ્ટેસવાદાએના પુત્ર (ભારીનદાર)	વા-કિરોમ્બર-સ્વ ર. દર દુશ,રસ્ટ/- (રૂપિયા ભારાઠ લાખ સોરાઠ ભગર અોગારાપ્રસાણ પુરા) ૧૪-કિરોમ્બર-સ્વ મુજબ	રદ્- કિરોમ્બર- સ્ર	યુલમ - ગામ પંચાયત યુ બ (મુ-ગ, બીજુ- વ, બીજુ- ય, બીજુ- 3, બીજુ- 4, લોટ નં. બી, સર્વે નં. નવો દૃદુ, સર્વે નં. વુખો 3પ, ગામ- શ્વપ્રસાયુર, વાલુકો- બિલોડા, સિસે- અરવાદી, ગુજરાત ખાતેની બિલાકત. ફોઝફેલ દર.હદ સો. સાર્ક	રૂપ. ૫૦,૦૦,૦૦૦/– (રૂપિચા પરસાર લાખ પુરા)	રૂ. ૫,૦૦,૦૦૦/– (રૂપિયા પશ્ચ લાખ પુસ)	રાહુલ 43 ર.૦૦ થી ૪.૦૦ વાગ્યા સુધી ૫ ગીનીટનાં અગાર્થાદિત વધારા રાહિત	૦૨−માર્ચ− ૨૪ =ાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અક્ષવા એ પહેલાં	સેચ સ્પ્રોલ ફાયનાન્સ એંક લીગીહેક., શામાનું સરનામું :- 308- 308, રીજો માળ, માર્થિક-ર, રાજાશ હલલ માટે, સેચ્છ્યુ હાઇલે, સમગદાવાદ- 3004¥	ભાન્યુ પ્રતાપ ટિલ – ૯૩૫૮૦૦૨૬૬૩ દાપેદલ : કપદાંગગ્રે aubankin ૦૬–માર્ચ–૨૩	
LosnAfoNo.: LBOO1000114349317 બિલિ હિનેય ભરૂ કે જેંદ્રએ ભરૂ-ના ભરત કુમારંગ્યા, હિનેમ બી ભરૂ કે ભરત કુમારંગ્યા, હિન્દ વેલારાગ, બિલિ ખાસે કેન, તેના ભાગીકાર બિલિ ભરૂ મારફત (સંક-દેવાદાર)	મુજબ ૧૮-નાવેમ્બર-સ્વ ફ્રા. ૨૪,૪૫,૨૦૯/– (રૂપિયા સોવીસ લાખ પીસ્તાલીસ હુભાટ બસ્ટશે નવ પુરા) ૧૫–નાવેમ્બર-સ્વ મુજબ	₹3- 6 44- 25	મ્યુન્દિયપલ લીમીટ પ્લોટ નં. ૧૧, સર્વે નં. ૨૪/૧, સાનિધ્દય બંગલો, ભૂષા ભવરુપાલ ટીડ, મોજે જિલ્લોડ, ભિરો સાબરકાંલ, ગુજરાત ખાતેની કીક્ષેલ્ક મિલકત, ક્ષેમકૃષ્ણ સ્ટ્રફ્ટ હવ થો.મી.	રૂર. ૧૪,૧૦,૦૦૦/– (રૂપિશા સૌદ લાખ પસ્સાસ હન્મર પુરા)	રૂ. ૧,૪૫,૦૦૦/ – (રૂપિસા રહેક લાખ પીટસાલીસ હન્મર પુરા)	૨૨- ફેબ્રુ- ૨૩ ૨.૦૦ લી ૪.૦૦ વાગ્યા સુધી પ મીનીટનાં ઝામાથોદિત વધારા રાહિત	૨૦- ફેલ્ડુ- ૨૩ નાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અશવા એ પહેલાં	એન્નુ સ્મોલ કુમ્પરવાન્ટર મેંક દીમીદેક., શામાન્ડું સરવાયું : ધોપ નં. ૧ લી મ, ગ્રાઉન્ક ક્લોટ, ગલ્લેક વાદિકા, રાઉકારી છુન રોક, દિમતન ગર, સાબરકાંઠા, ગુજરાત.	ભાગુ પ્રતાપ સિંઘ – દગ્રપ્ટ0045દુક છપેક્ષ્સ : autions@ autionkin ૧૭–હેબ્રૂ–૨૩	ા દાલા ગતે ૧૯ માટે 1900 માટે ગાંધ કરે છે	૧૫–ગાર્શ્વ–સ્ર રૂ. ૫,૨૦,૨૦૦/– (સંધિયા પાંચ દાખ દીરા હન્મર અસ્સો રીલ્સોર્ટ્સ પુરા) ૧૫–ગાર્શ્વ–સ્ર ગુન્છા	03- બન્વુઆરી -ર3	મુક્લમવગ્ર, પેહેલો માળ, જ્યાક એપાર્ટમેન્ટ, સાદતા નં ૨૫૯, સિટ નં. ૨૦, સિટી રાર્ચે નં. ૨૪૯૫, પોર્ટ નં ૫ ૪ ૩ અને ૧૪, ગુન્દો ભ્લોક નં. ૧૩૫ (વધ્યો ભ્લોક નં. ૧૯૧, મોલે-કીમ ક્લાહેટસ, પેટા જિલો-માંગરોળ, લિલો- શુરત, ગુભ્લત ખાતેની ગિલકત. સેમફળ કપટ	રૂ. ૪,૩૦,૦૦૦/– (રૂપિયા ચાર લાખ ત્રીરા હન્ભર પુરા)	રૂ. (રૂપિગ્રા પીરતાલીસ જન્મર પુરા)	૦૪-માર્ચ- સ્ક્ર ૨.૦૦ લી ૪.૦૦ વાગ્યા સુધી પ ગીનીટનાં આમાર્શદિત વધારા રાહિત	૦૨ માર્ચ- ૨૩ =ાં રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા મુદ્યી અક્ષવા એ પ્રદેર્લા	એચુ સ્મોદ ફાયનાન્સ એંક લીમીટેક., શામાનું સરનાયું :- ૧૧/૧૨, બીજો માળ, વેદ રોન્ટર, ન્યુ ઇન્ક્રમ ટેક્સ ઓફીસ સાથે, રસર બપ્રાર પાસે, રાડાબસ, બિસી શુસ્ત-3૯૫૦૦દ, ગુજરાત.	ભાન્યુ પ્રતાપ સિંદા – દગપટ૦૦૨૬૬૩ દાગેદાલ : suctiona@ aubankin o૬–ગાર્થ–૨૩	
Lan-Aba: LBOOTOB2700318802 બધીમાર્ચ્ય ક્રાયુલ્લાલ પાસ્ટિયા (ટેલાદાર), ક્રલ્લપાએમ પાર્ટીયા (ટેલાદાર), ક્લાસ) રૂસ્બમીલ્ય પાર્ટીયા (ટેલ ટેલાસ) રૂસ્બમીલ્ય પાર્ટીયા રાક્ષાર) રૂસ્બમીલ્ય પાર્ટીયા (ટેલ–ટેલાદાર)	વપ-ડિસેમ્બર-સ્વ રૂ. ૩,૩૫,૧૧૭/- (રૂપિયા ત્રણ લાખ પાંત્રીર હજાર સારસ્વે સ્વર પુરા) ૧૪-ડિસેખર-સ્વ મુજબ	२४-३)-२२	સર્વે નં. ૨૦, ધ્લોટ ૧૧, સેક્શન ૨, ક્લેટનં ૩, સાઉન્ડ કુલોટ, સતાનામ વિરેસ, લાયક્ય નગર, સેન્ટ મેરી સ્કુલ પાછલ, નવલપી સેક, રેલવે ક્રેસિંગ પારે, સાલુકો અને ભિયો મોટલી, ગુજરાત ખાતેની વિલક્ત. ક્રેઝક્શ ૩૨૧.૨૦ સો.કુક	રૂ. ૨,૨૦,૦૦૦/– (રૂપિયા બે લાખ વીસ &જાર પુરા)	રૂ. (રૂપિયા પચ્ચીસ હેળાર પુરા)	૨૨- કેબ્રુ- ૨૩ ૨.૦૦ લા ગ્લા સુધી પ ગીનીટનાં અમાર્થોદિત વધારા સહિત	ર ૦- કેંબ્લુ- ૨૩ નાં રોજ ૧૦.૦૦ શી ૫.૦૦ વાગ્યા મુશી અક્ષવા એ પહેલાં	એચુ શ્વેલ ક્લચનાવ્ય એક દીમેટિક., શાચનું રાસ્ત્વાનું :- કે કે સ્ટીલ સામે, સ્વ ચોક પાસે, સ્વાનાવા સેક મોરખી, ગુજરાત- કર્ફકપ્ટજ	ભાન્યું પ્રતાપ સિંઘ – દઉપ૮૦૦૨૬દ્ઉ શ્મેકલ : aubankin ૧ ૯–ફેબ્રુ–૧૩	Loan Alo No. : Loan Alo No. : LBOY 1087174475220 પશ્ચિત્ર ૨ અંગુસ્થાય જે જેલાબાદાવના પુત્ર (દેવાદાર), શ્રીમતી વિતાલબેન સ્ટેન્ટબૂલાય પશ્ચિત્ર (સંત- દેવાદાર), શ્રીમતી સવિતાબેન લેલા પટેલ (સંત-દેવાદાર)	વપ-માર્ચ-સ્ટ ગ્ર. દ્વુમ્પ્રાઇપ્ટ (રૂપિશા નવ શાખ પ્રેટિસાદીર ભગર સાતરો અશુલ્વન પુરા ગ્ર. વ. દુધ, દુપ્પ્ર- (રૂપિશા એક લાખ પાસક હબાર ધરસો ત્રેપ્તન પુરા) વપ-માર્ચ-સ્ટ મુખબ	03- બાલ્વુઆરી -ર3	ચો. હુદ મુકાગ-ક્લેટ નં. એપ, પહેલો માળ, ગલાબધારી સેપ્પલેસ, બાલેક નં. ૨૯૫, ગિલકત નં. ૧૯૪૬, મેલે-મુલાક, લાલુક્રે-એલપાક, લિયો-સુરત, ગુજરત. ફેમફળ ૧૮૩ ચો. હુદ	રૂ. દ્.૮ક,૦૦૦/– (રૂપિયા છ લાખ સીલ્થાંશી હભાર પુસ)	વેડા) કાંગ્રેડા કુલ્પાર કોંગ્રેડ કુલ્પાર કોંગ્રેડા કુલ્પાર કોંગ્રેડા કુંગ્રેડ	૦૪–માર્ચ– રર ૨.૦૦ સી ૪.૦૦ લાગ્યા સુધી પ ગીનીટનાં અભાચાદિત હધારા રાહિત	૦૨−માર્ચ− ૨૩ =1 રોજ ૧૦.૦૦ થી ૫.૦૦ વાગ્યા સુધી અક્ષવા એ પહેલાં	સેચુ સ્મોદ ફાયનાન્સ બૅક દીમિટેક., શામાં સસ્માર્ગુ ~ ૧૧/૧૨, બેજિ માળ, સે ૯ રોન્ટર, ન્યુ ઇન્કમ ટેક્સ ઓફીસ સામે, ટેસર બોફીસ સામે, રસર બાઝાર પારે, ચુવરાત.	ાયન્યુ પ્રતાપ શિંદા – દઉપટ૦૦૨૬૬૨ દાગેદાવા : suctors@ aubankin o€-સાર્થ-૨૩	
Lan Ar Na : Lan Ar Na : Lan Char 27 કે 353005 & Lan Char 27 કે 353005 & મુકેશ મળ દરિવાદ શહે ન મ બાદિવાદ માં દ્વીદાવા ન પાત્ર કરે મેં બોદિવાદ ન પાત્ર સિંદ ન પાત્ર મેં બોદિવાદ ન પાત્ર સિંદ ન માં દિવાદ સ્વા મેં મું સ્વ ઉત્તર ન માં કરે માં સુધ ન પાત્ર સ્વ સ્વ સ્વ સ્વ માં સુધ ન પાત્ર સ્વ સ્વ સ્વ સ્વ સ્વ સ્વ માં સુધ ન પાત્ર સ્વ	વપમારી-વર ફા. ૧૮,૬ર,૬૬/- (રૂચિયા અક્ષર ક્રમ્સ્યો આગ્રાસ્ટોસેટ પુરા આગ્રાસ્ટોસેટ પુરા સ. ૩,૫૩,૮૯૪/- (રૂચિયા ત્રણા લાગ્ર આહસ્ટો સેટાર્ટ્યુ વ.પમાર્ચ-વર મુજબ	ર3- ઑગષ્ટ-૨૨	રેલન્થુ રાવે નં. ૧૦૬, પૈકી, બંનં. ૪૯ , ઉત્સ્યા નં.૧, પી નં. ૮૩, દુારકેશ ન્યત્રરી, મંચે સ્થાયક, વિદ્યા શુસ્ત, ગુસ્સાત ખાતેની દિલાતનં. ગ્રેસ્ટ્સ દૃ૧.૮૯ સો.મી.	રૂં. (રૂપિયા વાટ લખા પ્રશ્નારા લભા પ્રશ્નારા લભા પ્રશ્નાર લભા પ્રશ	રૂપ ન (રૂપિસા એક લાખ પ્રચ્ચીસ બબાર પુરા)	રર- દેવુ- રહ ર.૦૦ વાગ્યા સુધી પ.૦૦ ગીનીટનાં અમારાદિત તધારા રાહિત	30- ફેબ્રુ નાં રોજ ૧.૦૦ લાગ્યા ૫.૦૦ લાગ્યા ૩.૦૦ લાગ્યા ૩.૦૦ લાગ્યા ૨.૦૦ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.૨ ૨.	એવુ સ્પેશ ફાચવાન્ટર બેંક લીમીટેક, શાચવું સારુવાનું - એશુ સ્પેલ ફાચવાન્ટ બેંક લીમીટેક, શાચવું સરુવાં, 'વર્શવ, વર, બીએ માળ, જેટ સેન્ટર, ન્યુ ઇન્કમ ટેક્સ એટ્ટીસ સાપે, સ્ટાર બાહ્ય પારે, સ્ટાર બાહ્ય પ્રશ્ન વ્રુટ્સ- સર્પળવર, ગુજરાત.	ભાન્યુ પ્રતાપ સિંદા – દ3પ૮૦૦૨ફદ્ઉ છોક્તર : autank in વત-ફેબ્રુ–૨૩	ાં ને અડ્યુ વેચારાની શરતો અને બિન્સમાં : માટે 19 કિસ્પોર્ડ એસેટનું Leang વેચારા "આં છે", "જે છે", "ભે છે" અને ક્ષેપ્ર આપ્રા વિનાના ધોરણે સિદમોર્ડ વેશરાર એટલે કે એગ્રુએસએડુબી તાડી કરાપ રહ્યું છે અને જશાવેલ કારણ બિદલા પર છે બાજે ને નારી (૩) આનાવાન નં કરાવુ વેચારામાં ભાગ લેવા માટે બીડ દરતાવેનો, ખેન કાર્ડ, હંપનીના વિસ્વામાં બોર્ડ રેપોલ્ટ્રા અને બોર્ડ છે આપ્રી, સરનામાંન કારણ બિદલા પર છે બાજે ને નારી (૩) આનાવાન નં કરાવુ વેચારામાં ભાગ લેવા માટે બીડ દરતાવેનો, ખેન કાર્ડ, હંપનીના વિસ્વામાં બોર્ડ રેપોલ્ટ્રા અને બોર્ડ છે આપ્રી, સરનામાંન કારણ અંગ કે અનાહન નં દરવગરવર વરવા સ્થળ સંગે અપ્રે છે છે બાજ સંગ્રુએસમાં છે નામાં છે છે બાજ સંગ્રે છે બાજ સંગ્રુએસ છે હાથનાના બેઠ વીપેટેડ, પંચળો અને કક્ષેપ્ર પ્લાગ, સદા વીગ બંજન અરાટીશી ખાસરા નં દર થી દલ, આમ સંગ્રેથાયા ક્લે. આ ગ્રાંડિસ માર્કેડ, ભાયુર – ૩૦૨૦૨૦, આપાયે સ્થોએલ ક્લો અને 2021 માતો શુક્ર વાયાય છે. એક વખત બોરલાયા ન્યોડ સુપાર અંધાની તે દર કરી સર્સને નહી. વધ્ય										